

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન જૂન 11 થી સુરક્ષા નિયંત્રણો સાથે, બધાં ઉદ્યાનો ફરીથી ખોલશે

ઉદ્યાનો રાત્રે 10 વાગ્યે બંધ થશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 8, 2020) – પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન અનુસાર, સીટી ઓફ બ્રેમ્પટન ગુરુવાર, જૂન 11 થી તમામ 500+ ઉદ્યાનો ફરીથી ખોલશે. આમાં શેડ (ખુલ્લા છાંયડો આપતા) અને પિકનિક શેલ્ટર્સ (ઉજાણી સ્થાનો), બેંચીસ, લીશ-ફ્રી ડોગ પાર્ક્સ, વ્હાઈટ સ્પ્રસ (સફેદ વ્યવસ્થિત) પાર્ક ડિસ્ક ગોલ્ફ કોર્સ, અને સ્કેટ પાર્ક્સ સામેલ છે (ચિંગકુસી પાર્ક સિવાય). ઉદ્યાનો રોજ રાત્રે 10 વાગ્યે બંધ થશે. ટેનિસ અને પિકલબૉલ કોર્ટ્સ, પીલ વિલેજ ગોલ્ફ કોર્સ અને બ્રેમ્પટન સેમિટરી પણ ખુલ્લા રહેશે.

બધાં રમતગમતના મેદાનો અને રમતોના સ્ટ્રક્ચર્સ, રમતના ક્ષેત્રો અને સગવડો, આઉટડોર ફિટનેસ સાધનો, આઉટડોર સ્વીમિંગ પુલ્સ, સ્પ્લેશ પેડ્સ/વોડિંગ પુલ્સ, વૉશરૂમ્સ, અને પીવાના પાણીની સિસ્ટમ્સ બંધ રહેશે અને લોકોની સંપર્ક સીમાથી દૂર રહેશે.

સમુદાયની સુરક્ષાની ખાતરી કરાવવાના વધારાના ઉપાયો તરીકે, તમામ આઉટડોર રમતના મેદાનો અને ફિટનેસ સાધનો નારંગી રંગની પ્લાસ્ટિકની વાડથી વીંટવામાં આવશે જેથી આ સગવડો બંધ રહે ત્યારે જાહેર જનતા દ્વારા ઉપયોગને મનાઈ કરી શકાય.

રહેવાસીઓને યાદ અપાવવામાં આવે છે કે ઓન્ટેરિયો ગવર્નમેન્ટના કટોકટી લુકમ અનુસાર, અત્યારના સમયે પાંચથી વધારે લોકોના સામાજિક મેળાવડાની પરવાનગી આપવામાં આવતી નથી. શુક્રવાર, જૂન 12, 2020 નાં રોજ વહેલી સવારે 12:01 વાગ્યાથી, આ પ્રોવિન્સમાં સામાજિક મેળાવડો પાંચ લોકોથી વધારીને 10 લોકો સુધી સીમિત કરવામાં આવશે. રહેવાસીઓ પોતાની સાથે ન રહેતી કોઈપણ વ્યક્તિથી ઓછામાં ઓછું 2.0 મીટર (કે છ ફૂટ)નું અંતર બધાં સમયે અચૂક જાળવવું રહ્યું.

સગવડો ખુલ્લે એટલે વધારાના કચરો એકત્ર કરતા કેન્સ ઉમેરવામાં આવશે, અને જરૂરિયાત મુજબ વધારાના નિરીક્ષણો અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવશે.

શેડ (ખુલ્લા છાંયડો આપતા) અને પિકનિક શેલ્ટર્સ (ઉજાણી સ્થાનો)

શારીરિક અંતર જાળવવાના પગલાઓ અમલમાં રહેશે. જ્યાં પણ શેલ્ટર્સ હોય ત્યાં શેડ (ખુલ્લા છાંયડો આપતા) / પિકનિક શેલ્ટર્સ (ઉજાણી સ્થાનો)માં કડક મહત્તમ ભોગવટો સીમાઓ પાર્ક્સમાંના સાર્થન બોર્ડ્સ પર સ્પષ્ટપણે ચિહ્નિત કરવામાં આવશે.

રહેવાસીઓને શેડ શેલ્ટર્સમાં ઉપયોગમાં લેવા પોતાની ખુરશીઓ લાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, કારણકે સીટી કર્મચારીઓ COVID-19 નો ફેલાવો ટાળવા ટેબલો અને ખુરશીઓની પહોંચ સીમિત કરશે. રહેવાસીઓએ પોતાની ખુરશીઓ ઉપયોગમાં લીધાં પછી ઘરે પરત અચૂક લઈ જવી. સીટી ઓફ બ્રેમ્પટનના ઉદ્યાનમાં છોડી દીધેલી કોઈ ખુરશીઓ ખસેડીને કાઢી લેવામાં આવશે.

અત્યારના સમયે પિકનિક શેલ્ટર્સ અને પાર્ક્સની જગ્યાઓમાં આગળ સૂચના ના આપવામાં આવે ત્યાં સુધી કોઈ બુર્કિંગ્સની છૂટ આપવામાં આવશે નહીં.

લીશ-ફ્રી ડોગ પાર્ક્સ

બ્રમ્પટનના ચાર લીશ-ફી ડોગ પાર્ક્સમાં કડક મહત્તમ ભોગવટો સીમાઓ સાઈન બોર્ડ્સ પર સ્પષ્ટપણે ચિહ્નિત કરવામાં આવશે.

- બ્રેમલી લિમિટેડ કમ્યુનિટી પાર્ક (1030 વિલિયમ્સ પાર્કવે)
- ક્લિસ ગિબ્સન પાર્ક (135 મેકલાફ્લિન રોડ નોર્થ)
- ડુગન પાર્ક (73 વોડેન સ્ટ્રીટ ઈસ્ટ)
- વ્હાઈટ સ્પ્રસ) પાર્ક (10302 હાર્ટ લેક રોડ)

બ્રમ્પટનના લીશ-ફી ડોગ પાર્ક્સ પર વધુ માહિતી માટે, [અહીં](#) ક્લિક કરો.

પાર્ક્સ એમ્બેસેડર પ્રોગ્રામ

રહેવાસીઓને વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવાના માર્ગદર્શનો અનુસરવાનું મહત્વ શીખવવું એ COVID-19 નો ફેલાવો રોકવા મહત્વની બાબત છે. જૂન 13 થી શરૂ કરીને, અઠવાડિક કામકાજના દિવસોની રાત્રીઓમાં અને અઠવાડિક રજાઓની રાત્રીઓમાં, અમલી આરોગ્ય અને સુરક્ષા ઉપાયો વિશે રહેવાસીઓને સલાહ આપવા સીટી કર્મચારીઓ લોકોની વધુ અવરજવર ધરાવતા પાર્ક્સમાં સક્રિય રહેશે.

કોર્પોરેટ સુરક્ષા સેવાઓ પાર્ક્સની દેખરેખ રાખવાનું ચાલુ રાખશે. બ્રમ્પટનના COVID-19 કટોકટી ઉપાયોના પેટા કાનૂનો અનુસાર, વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવાના નિયમનનું પાલન ન કરતા લોકોને દરેક ગુના દીઠ લઘુત્તમ \$500 દંડ થઈ શકે છે. રહેવાસીઓને બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.

COVID-19 હેલ્થ એન્ડ સેફ્ટી મેઝર્સ (આરોગ્ય અને સુરક્ષા ઉપાયો)

સમુદાયના આરોગ્ય અને સુરક્ષાને ટોચમાં ધ્યાનમાં લઈને, વ્યક્તિઓ વચ્ચે કડક ભૌતિક અંતર જાળવવાના ઉપાયો બ્રમ્પટનના પાર્ક્સમાં અમલી રહેશે. રહેવાસીએ પોતાની સાથે ન રહેતી કોઈપણ વ્યક્તિથી ઓછામાં ઓછું 2.0 મીટર (કે છ ફૂટ)નું અંતર બધાં સમયે અચૂક જાળવવું રહ્યું. સીટી રહેવાસીઓને પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવે છે.

સીટી ઓફ બ્રમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. નિયમિત અદ્યતન માહિતી માટે વેબસાઈટ www.brampton.ca/covid19 જુઓ, અને કોઈપણ સમયે સીટી ઓફ બ્રમ્પટન અને રીજીયન ઓફ પીલ સુધી પહોંચવા 311 નંબર પર કોલ કરો.

અવતરણો (ક્વોટ્સ):

“હવામાન હુંફાળું થઈ રહ્યું છે ત્યારે, અમે સમજીએ છીએ કે રહેવાસીઓ પોતાના ઘરોમાંથી બહાર જવા અને તાજી હવાનો આનંદ લેવા ઈચ્છશે. અમે સગવડો માત્ર ત્યારે જ ખોલીએ છીએ જ્યારે તેમ કરવું સુરક્ષિત હોય અને એ બાબતની ખાતરી કરાવવા અમે પીલ પબ્લિક હેલ્થ સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યાં છીએ. આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષા અમારી અગ્રતા બની રહે છે, અને મને વિશ્વાસ છે કે રહેવાસીઓ માર્ગદર્શનનો આદર કરશે અને વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર જાળવવાનું આચરણ કરશે જ્યારે તેઓ આપણાં ઉદ્દાનોનો આનંદ લેવા બહાર જાય.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન*

“રિઓપર્નિંગ અને રિક્વરી વર્કિંગ ગ્રૂપ મારફતે, આપણી સગવડો અને સુવિધાઓને ફરી ખોલવામાં વ્યાપક અભિગમ અપનાવવામાં આવતું હોવાની ખાતરી કરાવવા અમે સમુદાય સાથે અર્થસભર ચર્ચાઓ કરવાનું ચાલુ રાખીએ છીએ. અમારું ધ્યેય આરોગ્ય અને સુરક્ષા પર અગ્રતા રાખવાની સાથે સાથે, રહેવાસીઓ અને શહેરના તમામ હોદ્દાઓની જરૂરિયાતોનું કાળજીપૂર્વક સંતુલન કરવાનું છે.”

- માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“શહેરની સેવાઓ અને સગવડો સુરક્ષિતપણે ખોલવી એ સીટી ઓફ બ્રેમ્પટન અને અમારા કર્મચારીઓ માટે ટોચની અગ્રતા છે. અમે જવાબદારીપૂર્વક અને સુરક્ષિત રીતે શહેરની સેવાઓ ફરીથી ખોલતા હોવાની ખાતરી કરાવવા અમે જરૂરી પગલાઓ લેવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“ઉનાળો આવી ગયો છે ત્યારે, લીશ-ફી ડોગ પાર્ક્સ જેવી આઉટડોર જગ્યાઓ ધીરે ધીરે ખોલવાથી રહેવાસીઓને બહાર જવાની તક મળશે. આનાથી શારીરિક પ્રવૃત્તિ અને માનસિક સુખાકારીને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે, પરંતુ એ યાદ રાખવું મહત્વનું છે કે ખુલ્લી સગવડોનો અર્થ આપણે કામગીરી રહેવાનું બંધ કરવાનો થતો નથી. રહેવાસીઓએ COVID-19 નો ફેલાવો રોકવા ભલામણો અનુસરવાનું અચૂક ચાલુ રાખવું રહ્યું. અન્ય લોકોથી બે મીટર દૂર રહેવું, આ ગોઠવણોમાં લોકો અને કૂતરાની મહત્તમ સંખ્યાનું પાલન કરીને ટોળું ભેગું થતું ટાળવું, અવારનવાર અને દરેક મુલાકાત પછી હાથ ધોવા, અને જો બીમાર પડો તો પરીક્ષણ કરાવવું અને ઘરે રહેવું, આ બધાં આગળ વધવા માટે મહત્વના ઉપાયો છે.”

- ડૉ. લૉરેન્સ લૉહ (Dr. Lawrence Loh), ઈન્ટરિમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, પીલ પબ્લિક હેલ્થ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca